

## સંપાદકીય

આ મહિનાની શરૂઆત થતાં જ આપણે સૌ ખુશ થઈ જઈએ છીએ, કેમ કે આ મહિનો તેના રંગોત્સવ માટે પ્રસિદ્ધ છે. પરંતુ એકબીજા પર રંગ લગાવવા સિવાય આ રંગોની એક બીજી ભાષા પણ છે. શું તમે રંગોની આ વાત જાણો છો ? તો આવો કહું તમને રંગોની એક વાત છે ફક્ત એક સફેદ રંગ પણ રંગો છે તેમાં સાત ! જેમ સફેદ રંગ પોતાની અંદર સાત રંગોનો સમાવેશ કરે છે તે જ રીતે આપણા સૌમાં પણ દરેક રંગ છુપાયેલો છે. આ રંગ તમને સ્વંય સાથે જોડાણ કરાવે છે. જીવનને સંપૂર્ણ રીતે જાણવા અને માણવા માટે પોતાની અંદરનો દરેક રંગ છલકાવવો ખુબ જરૂરી છે

## વાર્તા રે વાર્તા....

વીજળીના શોધક થોમસ આલ્વા એડિસને વીજળીના વિવિધ ઉપયોગો અંગે ઘણી શોધો કરી હતી. આજે આપણે વીજળીથી કેટલા બધા લાભો લઈ શકીએ છીએ ! એ સર્વ સુવિધાઓનો યશ વીજળીના શોધક એડિસનને ફાળે જ જાય છે

તેણે વીજળીની શોધ કાર્ય બાદ વીજળીના બલ્બની શોધ અંગે પ્રયોગો શરૂ કર્યા. પ્રયોગોમાં તે એવો તો તલ્લીન બનેલો રહેતો કે તેને ખાવા-પીવાનું પણ કેટલીકવાર ભાન રહેતું નહોતું. તેના આ પ્રયોગોમાં તેનો એક મદદનીશ પણ જોડાયો હતો. બંને-જણ સતત પ્રયોગો જ કરતા રહેતા ! પાંચ-પચાસ નહીં, પણ પુરા બે હજાર પ્રયોગો એ બંનેએ કર્યા, છતાં બલ્બની શોધમાં તેઓ નિષ્ફળ જ રહ્યા. એડિસન તેમ છતાં જરાયે નિરાશ થયો નહીં.

પણ તેના મદદનીશનું ધૈર્ય ઓગળી ગયું ! તેણે એક દિવસ એડિસનને કહ્યું : 'આપણે બે હજાર પ્રયોગો કર્યા, છતાં આપણને કોઈ સફળતા મળી નહીં !

હવે, મારી ધીરજનો અંત આવ્યો છે. હું વધુ પ્રયોગો કરવા ઇચ્છતો નથી.' એડિસને મદદનીશને કહ્યું : 'તારા ધૈર્યનો ભલે અંત આવ્યો, મારા ધૈર્યનો અંત આવ્યો નથી ! તું ભલે વધુ પ્રયોગો કરવાનું છોડી દે, પણ હું તો વધુ ને વધુ પ્રયોગો કરવાનું ચાલુ જ રાખીશ. મારા પ્રયોગો બલ્બની શોધ ન થાય ત્યાં સુધી સતત ચાલુ જ રહેશે !'

પછી એડિસને એકલા રહીને પ્રયોગશાળામાં વધુ પ્રયોગો કરવા માંડ્યા. લગભગ ત્રણ હજાર પ્રયોગો બાદ બલ્બની શોધ કરવામાં તેને સફળતા મળી. આ સફળતા જોઈને તેમના ઘરે કોઈ એક પ્રતિષ્ઠ અખબારનો ખબરપત્રી આવ્યો.

તેણે પ્રશ્નોત્તરી દરમ્યાન વિજ્ઞાની એડિસનને એક પ્રશ્ન પૂછ્યો કે, 'ધારો કે, તમને આ ત્રણ હજાર પ્રયોગો બાદ પણ સફળતા પ્રાપ્ત ન થઈ હોત તો તમે શું કરત ?

એડિસનને ખુબ ધૈર્યપૂર્વક તે ખબરપત્રીને તેના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું : 'જો ત્રણ હજાર પ્રયોગો બાદ પણ હું નિષ્ફળ રહ્યો હોત તો પણ અહીં ઘરમાં બેસી રહેવાને બદલે હું પ્રયોગશાળામાં જ હોત અને આમ તમારી સાથે વાતચીત કરવાની મને કુરસદ હોત નહિ.'



## એન જે ડેસ્ક પર ઈ-કન્ટેન્ટ

અધ્યયન માટેનું દિશાદર્શન અને યોગ્ય વાતાવરણનું નિર્માણ જરૂરી સૂચનો દ્વારા વિદ્યાર્થીઓને જાતે શીખતાં કરવું એ એક ઉદ્દેશ છે.



- ફેબ્રુઆરી માસમાં નીચે મુજબ વિષયવસ્તુ એન જે ડેસ્ક પર અપલોડ કરવામાં આવ્યું છે.
- અંગ્રેજી માધ્યમમાં ગણિત વિષયના વિડીયો બનાવવાની શરૂઆત.

- સમગ્ર અધ્યયન સામગ્રીની ઝલક નીચે દર્શાવી છે:

Subject	Video Count	Timing
B.A	49	5:22:20
Biology	19	3:53:08
Chemistry	198	7:01:07
English	18	3:00:31
Gujarati	3	0:15:08
Mathematics	8	1:23:00
Maths (EM)	24	2:14:07
Sanskrit	2	0:27:29
Science	81	8:07:59
Social Science	2	0:12:05
	404	7:56:54

આ વિડીયો બનાવવાનું કાર્ય અવિરતપણે ચાલતું જ રહે છે, જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકાય અનેક વિદ્યાર્થીઓ પોતાની ઝડપે, પોતાના સમયે શીખતાં રહે.

“Nobody can go back and start a new beginning, but anyone can start today and make a new ending.”

## મનને ગમતાં સમાચાર



→ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ થી ધોરણ ૬ થી ૧૨ માં શ્રીમદ ભગવદ્ ગીતાનો શાળાના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે. જેનો મુખ્ય હેતુ એ પરંપરાઓ સાથે ગૌરવ અને જોડાણની ભાવના કેળવવાનો છે. તેમજ વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાનાં Theoretical lessons કરતા practical lessons નું જ્ઞાન આપવું મહત્વપૂર્ણ છે.

## વાંચવું ગમશે...



### 1.Outliers

-Malcolm Gladwell

### 2.Designing Your Life

- Bill Burnett

## એક ચપટી પ્રેરણા

i am only one ;  
**but still i am one**  
i cannot do everything,  
**but still i can do something**  
i will not refuse to do something  
**i can do.**

